

## GTU CCC રજીસ્ટ્રેશન માટે અગત્યની સૂચનાઓ

૧. ઓનલાઈન રજીસ્ટ્રેશન તા. ૧૫/૩/૨૦૧૮ થી ૨૧/૩/૨૦૧૮ સુધી ઓપન રહેશે. આ દરમિયાન ઉમેદવારોએ પોતાનું નામ (સર્વિસબુક પ્રમાણે), મોબાઈલ નંબર અને ઉચ્ચ પગારઘોરણ / બઢતી / લાંબા ગાળા ની નિમણૂંક ની બહાલીની ડ્યુ તારીખ લખવાની રહેશે. આ ત્રણ માહિતી પાછળથી બદલાશે નહિ. ઉપરની ત્રણ માહિતી આપવાથી ઉમેદવારોનો એક એપ્લીકેશન નંબર કોમ્પ્યુટર સ્ક્રીન પર બતાવશે જે ઉમેદવારે લખી લેવાનો રહેશે. ત્યારપછીના તમામ કાર્ય માટે આ એપ્લીકેશન નંબર નો ઉપયોગ કરવાનો રહેશે.
૨. તા. ૧૫/૩/૨૦૧૮ થી ૨૧/૩/૨૦૧૮ સુધીમાં ઉમેદવારે પોતાનો એપ્લીકેશન નંબર નાખીને માગેલી માહિતી એન્ટર કરવાની રહેશે. રજીસ્ટ્રેશન ફોર્મ સંપૂર્ણ ભરાઈ જાય પછી સેવ કરીને તેની એક પ્રિન્ટ કોપી કાઢવાની રહેશે.
૩. એક વખત પ્રિન્ટ લીધા પછી કોઈ જ માહિતી બદલી શકાશે નહિ.
૪. આ પ્રિન્ટેડ રજીસ્ટ્રેશન ફોર્મમાં ઉમેદવારે યોગ્ય જગ્યાએ પોતાની સહી કરવાની રહેશે. ઉપરાંત ખાતાના વડા/આચાર્યની સહી તથા સિક્કો કરાવાના રહેશે. આ સહી તથા સિક્કા વગરના ફોર્મ અધૂરા ગણાશે અને સ્વીકારવામાં આવશે નહિ.
૫. રજીસ્ટ્રેશન ફી રૂ.૧૦૦ (માત્ર થીયરી પરીક્ષા માટે), રૂ.૧૦૦ (માત્ર પ્રેક્ટીકલ પરીક્ષા માટે), રૂ.૨૦૦ (થીયરી અને પ્રેક્ટીકલ પરીક્ષા માટે) છે જે ઉમેદવારે ઓનલાઈન ભરવાની રહેશે. ક્રેડીટકાર્ડ / ડેબીટકાર્ડ / ઈન્ટરનેટ બેન્કિંગ માટે બ્રાંચ નામ માં SBI લખવાનું રહેશે.
૬. પ્રિન્ટેડ રજીસ્ટ્રેશન ફોર્મમાં જો ફોટો સ્પષ્ટ દેખાતો નહિ હોય તો ઉમેદવારે પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવી, કોસ સહી કરવાની રહેશે. તથા સ્કેન કરેલ ફોટો પોતાના એપ્લીકેશન નંબરની સાથે ccc@gtu.edu.in પર મોકલવાનો રહેશે. ફોટો સ્પષ્ટ દેખાતો હોય તો પછી થી બદલાશે નહિ.
૭. રજીસ્ટ્રેશન ફોર્મ તથા કચેરી તરફથી મળેલ ઓળખપત્ર માં નામ સરખું હોવું જરૂરી છે. જો નામ માં તફાવત હશે તો અરજી સ્વીકારવામાં આવશે નહિ.
૮. GTU માં જમા કરવાના ડોક્યુમેન્ટ્સ નીચે મુજબના હોવા જોઈએ.
  - A. ઓરીજનલ રજીસ્ટ્રેશન ફોર્મ પ્રિન્ટઆઉટ ઉમેદવાર ની સહી તથા HOD ની સહી અને સિક્કા સાથે.
  - B. ઓરીજનલ બેંક ચલણ કોપી (ડીપોઝીટર કોપી)
૯. ઉમેદવારે પોતાની એપ્લીકેશન દર્શાવેલ પુરાવા સાથે GTU માં વ્યક્તિગત આવીને અથવા પોસ્ટ થી નીચેના સરનામાં પર તા.૨૬/૩/૨૦૧૮ (જાહેર રજાના દિવસો સિવાય) સુધીમાં પહોંચાડવાની રહેશે.

રજીસ્ટ્રાર,  
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી  
વિશ્વકર્મા સરકારી કોલેજ ની પાસે,  
વિસત ત્રણ રસ્તા ની પાસે,  
સાબરમતી કોબા હાઈવે,  
ચાંદખેડા - અમદાવાદ. ૩૮૨૪૨૪.

Envelope ના ઉપર ના ખૂણા પર **CCC EXAM FORM** લખવાનું રહેશે.

૧૦. તા.૨૬/૩/૨૦૧૮ પછી એપ્લીકેશન સ્વીકારવામાં આવશે નહિ.
૧૧. પોસ્ટમાં થતા વિલંબ માટે GTU જવાબદાર રહેશે નહિ.
૧૨. એપ્લીકેશન ફોર્મ ની પૂછપરછ માટે [079-23267616](tel:079-23267616) પર સંપર્ક કરવો.
૧૩. રોજના અંદાજીત ૧૮૦ પરીક્ષાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
૧૪. દરેક ઉમેદવારે પરીક્ષા દરમિયાન અસલ ડ્રાઈવીંગ લાયસન્સ, આધારકાર્ડ, પાસપોર્ટ, ઈલેક્શનકાર્ડ અથવા પાનકાર્ડ (આ બધામાંથી કોઈ એક) ફરજિયાત લાવવાનું રહેશે.

\*\*\*\*\*